



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલ, ઉસ્માનપુરા, આશ્રમરોડ, અમદાવાદ-14

ફોન : (ઓફિસ) 27545051 - 54. ફેક્સ : (079)-27545061

ઈમેલ : auda_urban@yahoo.co.in વેબસાઈટ : www.auda.org.in

FORM: D

નમુનો: ધ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૭૯, નિયમ-૧૦

વિકાસ માટે પરવાનગી

શ્રી JAISHIL RATILAL PATEL AND OTH'S/B-10, NEW ADHYASHAKTI SOCIETY, B/H FALGUN SOCIETY, SATELLITE, AHMEDABAD, 380015 ને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 (સન. 1976 ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં 27) ની કલમ-29 (1)(i), 29(1) (ii), 49(1) (b) હેઠળ મોકલે ગામ SHELA તાલુકો SANAND જિલ્લો

AHMEDABAD નગર રચના યોજના નં. T.P.3(SHELA) ડે.સ.નં./બ્લોક નં 51/B હિસ્સા નં -- મુળખંડ નં 47/2 અંતિમખંડ નં 47/2 સબપ્લોટ નં 0 ડેનામેન્ટ નં BLOCK:A+B+C+D ની

5221.00 ચો.મી

જમીનમાં તેમની હદમાં નીચે વર્ણન કર્યા પ્રમાણે આ સાથેની શરતોને આધીન વિકાસ પરવાનગી આપવામાં આવે છે.

બિલ્ડિંગ ટાઇપ : Residential Affordable Housing કામેનું વર્ણન:

અ.નં. (1)	માળ (2)	બાંધકામ(બિલ્ડઅપ)નું ઉપયોગી ક્ષેત્રફળ (ચો.મી.) (3)	બાંધકામનો ઉપયોગ (4)	એકમની સંખ્યા (5)	રિમાર્ક (6)
1	સેલર/બોયરુ (૧)	3497.76	PARKING	---	Residential Affordable Housing 70.00 mt Height
	સેલર/બોયરુ (૨)	3409.48	PARKING	---	PAYMENT F.S.I.: 11486.20 SQ.MT.
2	ગ્રાઉન્ડ ફ્લોર (ફોલોપ્ટી-થી)	1192.85(S.P)+666.16(H.P)+42.75+21.71	PARKING+SHOP+(Soci.Ami)+st.cb	28(S.)	
3	ફર્સ્ટ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	TOTAL UTILIZED F.S.I.: 26771.99 SQ.MT.
4	સેકન્ડ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
5	થર્ડ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	TOTAL TDR F.S.I.: 5887.99 SQ.MT.
6	ફોર્થ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
7	ફિફ્થ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	TOTAL SHOPS 28 UNITS
8	સીક્સથ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	TOTAL RESIDENTIAL 374 UNITS
9	સેવેનથ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	TOTAL 402 UNITS
10	એઈઠ્ઠા ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
11	નાઈનથ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	GROUND LEVEL STAIR IN COMMON PLOT
12	ટેન્થ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
13	ઇલેવેનથ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	SOCIETY AMENITIES IN COMMON PLOT
14	ટુવેલ્થ ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
15	થર્ડીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
16	ફોર્થીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
17	ફિફ્થીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
18	સિક્સીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
19	સેવેનીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
20	એઈઠીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
21	નાઈનીન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
22	ટુવેન્ટી ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
23	ટુવેન્ટીવન ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
24	ટુવેન્ટીટ્ર ફ્લોર	1545.48	RESIDENTIAL	17	
25	ટુવેન્ટીથી ફ્લોર	---	---	---	
26	ટુવેન્ટીફોર ફ્લોર	---	---	---	
27	ટુવેન્ટીઠાથ ફ્લોર	---	---	---	
28	સ્ટેર કેવીન	263.90	---	---	
29	મશીન રૂમ	---	---	---	
30	O.H.W.TANK	178.35	---	---	
	કુલ:	43273.52	RESIDENTIAL+SHOP+PARKING	402	

ખાસ શરત: 1. પ્રકાશના સુચિત બાંધકામ અંગે Chief Fire Officer-AMC DT:17/04/2023 ના અધિગ્રાસ મુજબ બાંધકામપૂર્ણ થયે, તપસગ્રા પ્રમાણપત્ર મેળવતાપહેલાં Fire Service Officer નું ના-વૈંધ્યા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. તથા C.G.D.C.R મુજબ "Fire Protection Consultant" ની નિમણૂક કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 2. સરકારથી ના તારીખ/5/2015 ના નોટીફિકેશન મુજબ બિ.યુ પરપીઝન મેળવતાં પહેલાં જરૂરી INSURANCE મેળવી ને રજુ કરવાના રહેશે. 3. As Per applicable Provision of Real Estate Regulation and Development Act-2016, Developer/promoter shall not Make Advertisement For Sale, Marketing, Booking, Or Offer For Real Estate Projects like plot, Apartment Or Building or Part of their, Until The Registration Is Done with Gujarat Real Estate Regulatory Authority (RERA). 4. રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-2016(RERA)ની ક્લોઝર્સ 18.(2). (II) મુજબ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગી વખતે અરજદારથી દ્વારા નોટીફિકેશન બાંધકામ રજુ કરવાની રહેશે. 5. શહેરી વિકાસ અને શહેરી મુદ્દા નિયંત્રક વિભાગનાં કરાવેલ કમ્પ્લેક્સ ઈસ્યુ-10/2016-2331-તા. 11/05/2016 મુજબ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગી (એડિશન-ઓફરેશન) ના કેસોમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-2016(RERA) ની ક્લોઝર્સ 18.(2). (II) મુજબ બાંધકામના બેઝનિયાના (2/3) એલોટીની સમતી (નોટીફિકેશન બાંધકામ) મેળવ્યા બાદ રીવાઈઝ્ડ વિકાસ પરવાનગીની કાર્યવાહી કરવામાં આવશે. 6. બિ.યુ પરપીઝન મેળવતાં પહેલાં રી.જી.ડી.આર-2016 મુજબ રજુ સોલાર એનર્જી ઈન્સોલેશન કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 7. સ્થળે બાંધકામ કરતા સમયે ત્યાં ધૂળ-માટી ન ઠે તે માટે જરૂરી તહેદારી સાધવાની રહે તથા સાઈટને સલામતી ઝીન-નેટ ની તથા જરૂરી મેટ્રી કનર કરવાની શરતે વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 8. પોલિટિકલ તથા રીલિગિયસ ટીકીંગોનું આયોજન તથા તે અનુસાર કબજા પલબીંગ સીક્રીયનું આયોજન કરવાનું રહેશે. તે શરતે આ વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 9. સરકાર સેફ્ટી અર્થે બેઝમેન્ટના ખોદાણ પૂર્વે કાશાફરમ વોલનું આયોજન કરવાની શરતે વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 10. વરસાદી પાણીના નિકાલ માટે બેઝમેન્ટમાં ચોચ કેપેસિટીના ડિસ્પાઈ વંપનું આયોજન કરવાનું રહેશે. 11. બિ.યુ પરપીઝન મેળવતાં પહેલાં PAYMENT F.S.I CHARGE નાં 12-કલાની તમામ રકમની ભરપાઈ કરી રીગીસ્ટર રજુ કરવાની રહેશે. 12. તારીખ/05/2023 ની Environment clearance certificate મુજબની શરતોને આધિન વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 13. તારીખ/06/2023 ની રીજ ની T.D.R. FSI અન્વયે નગર વિકાસ અધિકારી, આ.યુ.કો. નાં પત્રમાં જણાવ્યા મુજબનાં પ્રોજેક્ટની બિ.યુ. મેળવ્યા બાદ જ નક્કામાં "Purple" ટેપ થી દર્શાવેલ T.D.R. FSI અંતર્ગત બાંધકામ કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 14. CGDCR 2016 ની ક્લોઝર્સ 18.(2). (II) મુજબ રજુ કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 15. STRUCTURE EXPERT COMMITTEE ના તારીખ/10/2023 ના કરાવેલ કમ્પ્લેક્સ ઈસ્યુ-10/2016 ના ચોક્કસ-એ મુજબ ની શરતો વાંચીને તારીખ/10/2023 થી રજુ કરેલ બાંધકામ મુજબ વર્તવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 16. બિ.યુ પરપીઝન મેળવતાં પહેલાં રી.જી.ડી.આર-2016 મુજબ નિયુક્ત કરેલ બેચમેન્ટ મુજબ ના સુચવ્યા મુજબનાં રાઈવાઈ સાઈટ એનક્લોચર, સુપરવાઈઝર ની નિમણૂક કરવાની શરતે સદર વિકાસ પરવાનગી આપવામાં આવે છે. 17. રી.જી.ડી.આર મુજબ જરૂરી ડ્રેનેજ વ્યવસ્થા તથા સીવરેજ નિકાલ ની વ્યવસ્થા કરવાની રહેશે, તથા બાંધકામમાં ડ્રેનેજ કનેક્શન મેળવી લેવાનું રહેશે. 18. નક્કા દ્વારા રીપોર્ટ માં સૂચિત SEWAGE TREATMENT PLANT સહીત ની ડ્રે-વોટર રીસાઈકલિંગ ની કોન્ટ્રાક્ટને આધિન સદર વિ.પ. આપવામાં આવે છે. તથા પ્રીમાઈસીસ ની બહાર ડ્રેનેજ કોન્ટ્રાક્ટ ના થાય તેની તહેદારી સાધવાની રહેશે.

નોંધ પર ચેરમેનશ્રીની સહી છે

IFP No/E-nagar : JSK/09/2023/0077

ક્રમાંક: PRM/76/9/2023/3

તારીખ: 04/01/2024



રવાના કર્યું, મારફત

અધિકારી
જુનિયર નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

અમદાવાદ

અધિક મુખ્ય નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

11 JAN 2024

ખાસ શરતી:-

- ૧ અ વિશ્વ સંસ્કૃતિભાગીની સી જી ડી સી આર ના વિનિયમ નં.૨૦ મુજબ તેમજ અન્ય લઘુ પડતા કાયદા/નિયમો અન્વયેની પરવાનગીઓ માતાની નથી.
- ૨ અ વિશ્વ સંસ્કૃતિભાગીને વ્યાજ સહાય ઉપર વિશ્વસ શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ ફોર્મ નં.ટ(૪) નું એનક્ષર, રજીસ્ટ્રારલ ફોઈચ, વકીલ ફોઈચ તથા સોઈલ હિસ્ટોરીકાન ટીપોટેસ નિયામનુંઆર રજૂ કરવાના રહેશે.
- ૩ વિશ્વ સંસ્કૃતિભાગીને વ્યાજ સહાય ઉપર વિશ્વસ શરૂ કરતા પહેલા સાત દિવસ અગાઉ ફોર્મ નં.ટ(૪) નું એનક્ષર, રજીસ્ટ્રારલ ફોઈચ તથા સોઈલ હિસ્ટોરીકાન ટીપોટેસ નિયામનું આર રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાંધકામ શરૂ કરવાનું રહેશે. અ.
- ૪ બાંધકામ નીચેના દરેક તબક્કે ફોર્મ નં-૧૦ માં દર્શાવેલ મુજબ કમ્પ્લેમેન્ટ ટીપોટેસ તથા ફોર્મ નં ૧૧ માં દર્શાવ્યા મુજબનું પ્રોજેક્ટ સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે અને સત્તામંડળ તરફથી પરવાનગી મેળવ્યા બાદ જ આગળના તબક્કાનું બાંધકામ શરૂ કરવાનું રહેશે. ૫. છેલ્લા માળના બાંધકામ વખતે ૬. છેલ્લા માળના બાંધકામ વખતે
- ૫ પીએસ આશવા ભોરાયનું બાંધકામ હોય તો ભોરાય ઉપરનો સ્લેબ હરવામાં આવે તો પહેલાં બ. પ્રથમ માળના ૮. બહુમાલી મકાનમાં વચોચા માળના બાંધકામ વખતે ૯. બહુમાલી મકાનમાં વચોચા માળના બાંધકામ વખતે
- ૬ સી જી ડી સી આર ની જોગવાઈ તથા સરકારીની તા.૨૯-૫-૨૦૧૭ ના રજૂઆત રોકડી ખાતેના કુલમના વિનિયમ નં.૩ અનુસાર બાંધકામના સ્થાની જરૂરિયાતોની જોગવાઈઓનું પાલન થયેલી સ્થળ ઉપર બાંધકામ શરૂ કરવાનું રહેશે.
- ૭ રોપીડેટ ટેક તથા સોફ્ટવેરની સાર્વજિક તથા ગોપ્ય નેશનલ માઈલિંગ ટેક (અઈએસ ૨૪૦૦) તથા સી.જી.ડી.સી.આર ના વિનિયમ નં.૧૩, ૧૦.૧ મુજબ સીવેજ ના નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આઈકેઆર/ઈજીઆર/
- ૮ રજીસ્ટ્રારલ ઓફીસ/રોકેટ ઓફ વહેસ/માઈટ સુપરવાઈઝર/કેલબર/પરમીટ માલિકની રહેશે.
- ૯ રીડ ફાસ્ટ ઓફીસ/સી. અ. યુ.કો.પો. ના અધિકાર મુજબ તમામ નિયમો અને શરતોનો મુકલપણે અમલ કરવાનો રહેશે.
- ૧૦ ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટની જોગવાઈ મુજબ ટેલીફોનની સુવિધા માટે ખાસ જોગવાઈ જમીન માલિકે કરવાની રહેશે.
- ૧૧ સી.જી.ડી.સી.આર. વિનિયમ નં.૫.૨ તથા ૫.૩ મુજબની તમામ માહિતી સ્થળ ઉપર (નોટીસ બોર્ડ)/પ્રસિદ્ધ કરવાની રહેશે.
- ૧૨ બાંધકામ પૂર્ણ થયા બાદ બાંધકામનો ઉપયોગ શરૂ કરતા પહેલા નિયામનુંઆર અંગેની બાંધકામનું વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ શરૂ કરવાનો રહેશે.
- ૧૩ ૧૦.૬.૬.ટી.વી. સ્કીમ સરકાર સી ઢાસ મંજૂર થયેલ, ટી.વી.ઓ.દારા નિર્ણય લેવામાં આવશે તે બાંધકામ કરશે.
- ૧૪ રેલવે સી ૩૦.૦ મી. કન્વેલ લાઇનમાં આવતા મકાનોનું બી.યુ. પરમીટન લેતાં પહેલાં રેલવેની N.O.C લાવવાની રહેશે.
- ૧૫ સી.જી.ડી.સી.આર વિનિયમ નં.૧૬ તથા ૧૯ મુજબ અરજદારની/કેલબર/પરમીટ/રજીસ્ટ્રારની ઓ ઓ વર્તવાનું રહેશે.

शर्तः:-

- શરતો:-
- વિકાસ પરવાનગી પત્રમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવશે તો સત્તામંડળ તે શરતોનો અમલ જવાબદાર ઇતમન/સામાના ખર્ચે અને જોખમે કરાવી શકશે અને સત્તામંડળના તેવા કુચને લીધે જે નુકસાન, ખોટ કે હરકત થાય તે બદલ કોઈપણ વ્યક્તિને બદલો મળશે નહીં.
 - વિકાસ પરવાનગીના કારણે અરજદારને સી.જી.ડી.સી.આર.૩.૩.૧.૧(A,B,C,D,E) અંગેની મંજૂરી મળતી નથી પરંતુ બાંધકામ અંગેની મંજૂરી આપવામાં આવે છે.
 - વિકાસ પરવાનગીથી આનંદી કરશે અને સત્તામંડળની કોઈપણ જવાબદારી રહેતી નથી.
 - મુમકારપા નગર રચના યોજનામાં ફાળવવામાં આવેલ અંતિમખંડની ફદ, માપ, ફોટા, તથા અન્ય સર્વેચીટ ઇન્જિનિયર/સર્વેયર દ્વારા ફેરફારને પાત્ર છે.
 - પ્લોટની ફદ, આંતરિક રસ્તા ઉપર, શેડના પ્લોટમાં કોઈને અંતરય રૂપ ન થાય, તે રીતે ચોંટાડવાનો સી.જી.ડી.સી.આર ના વિનિયમ-૧૧(III)-17 નુકલના (સી.જી.ડી.સી.આર રોડવલ કમાં-૧૨ મુજબના) ઉગાડવાનાં રહેશે વુક્ષો ની ફરતે જરૂરીયાત મુજબ ટ્રી ગ્રાફ રાખી વુક્ષો ની શરતોભંગ રાખવાની જવાબદારી જમીન માલિક તથા વિકાસ પરવાનગી મેળવનારની રહેશે.
 - દેખાઈકમાં દર્શાવેલ આંતરિક રસ્તાઓ પાકા કરવાના રહેશે.
 - વ્યવસ્થિત વાસ્તવ શહેરી વિકાસ સત્તામંડળ તરફથી વિકાસ માટેના જે નિયમો તથા જોડાઈત કચાચ તે જમીન માલિક, ફિતસંબંધ મરાવતી વ્યક્તિ/સંસ્થા તેમજ અરજદારને બંધનકર્તા રહેશે.
 - સદર વિકાસ પરવાનગી અનુસરે જમીન માલિકમાં ફેરફાર થાય અથવા આ પરવાનગી સાથે સંબંધાયેલ રજુ નેશન ધરાવતી કોઈ વ્યક્તિ બદલવા તો નવા જમીન માલિક અંગેના પુરાવા રજુ કરે ત્યાં સુધી તથા રજુનાશય ધરાવતી નવી વ્યક્તિની નિમણૂક ન થાય ત્યાં સુધી સી.જી.ડી.સી.આર./સી.જી.ડી.આર ના વિનિયમ ૪.૫/૪.૬ મુજબ વિકાસ પરવાનગી નિર્ભરતી ગણાશે. સદર સમય દરમિયાન થયેલ બાંધકામ બિનાપિકડત ગણાશે.
 - સદરશીના તા.૨૯-૫-૨૦૦૧ ના સુક્રમરલ સેફ્ટી અંગેના યોજનાર XI ના વિનિયમ ૧૩,૧૪,૧૫ ની જોગવાઈ ખનુસાર લૂચા ખેતી સુરક્ષા, સંકલ્પત અંગેની સુરક્ષા, બાંધકામ તથા બાંધકામમાં વપરાતા ઉપચારની માલ સામાનની ગુણવત્તા અને તેની ચકાસણી બાંધકામની સિદ્ધિતા તથા આગ અંગેની ચકાસણી તેમજ અન્ય બાંધકામક બાબતે અંગે નિષ્ણાંતોની સલાહ સૂચન મુજબ પગલા લેવાની તથામ જવાબદારી આફિસર/ઇન્જીનેર/ સુક્રમરલ ઓફીસર/કલેક ઓફ વલેક્સ/સાઈટ સુપરવાઈઝર/ફેલપર/જમીન માલિકની રહેશે. આ અને સત્તામંડળ ની કોઈ જવાબદારી રહેશે નહીં.
 - આ વિકાસ પરવાનગી પત્ર મંજૂરી આપ્યા તારીખથી બાર માસ સુધીજ અમલમાં રહેશે. ત્યારબાદ અધિનિયમની કલમ-૩૨ મુજબ વિકાસ પરવાનગીની મુદત વધારવાની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે.
 - ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૩૩ મુજબ વિકાસ યોજનામાં જો કોઈ ફેરફાર થાય તો સત્તામંડળ આપેલ વિકાસ પરવાનગીમાં ફેરફાર કરી શકશે અથવા વિકાસ પરવાનગી રદ કરી શકશે.
 - સી.જી.ડી.સી.આર/સી.જી.ડી.આર ના વિનિયમ (PART-1) / ૩.૪/૪.૬ મુજબ અરજદારશીમે ખોટી રજુઆત અથવા ખોટા દસ્તાવેજ પુરાવા રજુ કરેલ ફરતે તો આપેલ વિકાસ પરવાનગી આપો આપ રદ થયેલ ગણાશે.
 - મકાન અને અન્ય બાંધકામ કામકારા (રોજગારનું નિયમન અને સેવાની શરતો) ધારો-૧૯૭૬ કેટલ દરેક માલિકે બાંધકામ પૂર્વે શરૂ કરવાના ૩૦(ત્રીસ)દિવસ પહેલાં સદર કાયદા હેઠળના નિયત રોમ-૬ મુજબની નોટીસ તેમજ બાંધકામ શરૂ કરવાના ૬૦ દિવસમાં જરૂરી સાઈટની નોંધણી/કાયદેસર ઈન્કવીરીલ સેફ્ટી ઓફ હેલ્થની કલેરી, ૩જી,પ્રતોમાલ,શખલવન, ગનહાલમની બાજુમાંપાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે કરાવી તે અંગેનું પ્રમાણપત્ર મેળવી તેની નકલ અચેની કલેરીએ રજુ કરવાની રહેશે.
- રવાના કર્યું, મારફત

रवाना कर्तुं, भारत

11 JAN 2024

बसही /-

અધિક મુખ્ય નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સંસ્થામાં
અમદાવાદ

નોંધ પર ચેરમેનશ્રીની સહી

IFP No/E-nagar : JSK/09/2023/0077
 शास: PRM/76/9/2023/3
 तारीख: 04/01/2024



જુનિયર નગર નિયોજક

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ.